



જનસંપર્ક અધિકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૦/૦૨/૨૦૧૯ રવિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૬૬/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૫૮ કેસ કરી, ૫૬ વ્યક્તિઓને ઝડપી, ૬૧૧ લીટર દેશી દારૂ, ૧૧૭ બોટલ ઈંગ્લીશ દારૂ અને ૧૧ બીયરટીન કબજે કર્યા હતા. તેમજ જુગારધારા હેઠળ ૦૨ કેસ કરી, ૦૪ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૩,૨૬૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૬૭/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૪૯ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી.૯૩ મુજબ ૦૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ઘરફોડ :-

સમાચાર યાદી નં.૨૬૮/૧૯

વાડજ : નિરવભાઈ બીપીનભાઈ પટેલ (રહે.નંદીગ્રામ સોસાયટી-૧ સંઘવી રેલ્વે કોસીંગની નજીક વાડજ) એ વાડજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૮/૦૨/૧૯ ના કલાક ૧૦/૩૦ થી તા.૦૯/૦૨/૧૯ ના કલાક ૯/૪૫ સુધીના સમયગાળા દરમ્યાન પોતાના મકાનનો દરવાજો ખોલી, અજાણી વ્યક્તિ મકાનમાં પ્રવેશ કરી, તિજોરીમાંથી (૧)સોનાની બંગડી નંગ-૪ (૨) સોનાના પાટલા નંગ-૨ (૩) સોનાની મગમાળા (૪) મંગળસુત્ર (૫) સોનાની ચેઇન (૬) મોતી અને ગજરીની માળા મળી તમામ દાગીના ની કુલ કિંમત રૂપિયા ૨,૬૨,૫૦૦/- અને રોકડ રૂપિયા ૫૪,૦૦૦/- મળી કુલ રૂપિયા ૩,૧૬,૫૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી જે.એ.રાઠવા ચલાવે છે.

સોનાની ચેઇન ખેંચી તોડી લઈ ગયો :-

સમાચાર યાદી નં.૨૬૯/૧૯

વાસણા : મીનાબહેન પ્રદિપભાઈ શાહ (ઉ.વ.૬૮)(રહે,ટ્રસ્ટનગર સોસાયટી વિભાગ-૧ આર.બી.આઇ. ક્વાર્ટર્સ ની સામે જીવરાજપાર્ક) એ વાસણા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૯/૦૨/૨૦૧૯ સાંજના ૫/૩૦ વાગ્યાના સુમારે એક્ટીવા ઉપર આવેલ એક પુરૂષ(૨૫ થી ૩૦ વર્ષના આશરાનો) મીનાબહેનના ઘર નજીક થી તેમના ગળામાંથી સોનાની ચેઇન હિરાના પેડલ સહિતની કિંમત રૂપિયા ૪૭,૦૦૦/- મતાની ખેંચી તોડી લઈ નાસી ગયો હતો. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.બી.ચૌધરી ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૨૭૦/૧૯

ઓઢવ : કનૈયાલાલ સોમાભાઇ સોલંકી (ઉ.વ.૩૧)(રહે.રઘુવીર એપાર્ટમેન્ટ અર્બુદાનગર ઓઢવ) એ અગમ્ય કારણસર તા.૦૯/૦૨/૨૦૧૯ બપોરના ૧/૪૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે રૂમના પંખા સાથે ઢોરી બાંધી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે ઓઢવ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી કાંતીલાલ જીવાજી ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાઢ શહેર.
પોલીસ કમિશનર વતી.